

M.A. (PSYCHOLOGY) Semester - 3 (CBCS) Examination
Oct/Nov-2022 (NEW COURSE)
Behavior Modification (Elective-5 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન.૧ વર્તન ફેરફાર એટલે શું? તેના પાયાના ખ્યાલ સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૧ વર્તન ફેરફારના આધારસ્તંભ સમજાવો.
- પ્રશ્ન.૨ પરંપરાગત મુલ્યાંકન અને વાર્તાનીક મૂલ્યાંકન વચ્ચે નો તફાવત સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૨ ઔપચારિક અને અનૌપચારિક વર્તન વિશ્લેષણ સમજાવો
- પ્રશ્ન.૩ ક્રમબદ્ધ અસંવેદનીકરણ વિસ્તાર પૂર્વક સમજાવો (૧૪)
 અથવા
- પ્રશ્ન.૩ મોડેલીંગ અને વાર્તાનીક પૂર્વતાલીમ ચર્ચો
- પ્રશ્ન.૪ પ્રબલન એટલે શું? તેના પ્રકાર ચર્ચો (૧૪)
 અથવા
- પ્રશ્ન.૪ પ્રબલનના ઉપક્રમોની ચર્ચા કરો
- પ્રશ્ન.૫ કોઈ પણ બે ટુંક નોંધ લખો. (૧૪)
1. વિશ્રાંતિ ની પ્રયુક્તિ
 2. વર્તન વિશ્લેષણના હેતુ
 3. દૃઢાગ્રહ તાલીમ
 4. સંભાવ્ય સ્થિતિઓના પ્રબંધ

ENGLISH VERSION

- Q.1 What is behavior modification? Explain it's basic concepts. (14)
 OR
- Q.1 Explain the foundations of behavior modification.
- Q.2 Explain the difference between traditional assessment and behavioral assessment. (14)
 OR
- Q.2 Explain formal and informal behavioral assessment.
- Q.3 Explain systematic desensitization. (14)
 OR
- Q.3 Discuss the modelling and behavior rehearsal procedures.
- Q.4 What is reinforcement? Explain it's types. (14)
 OR
- Q.4 Discuss schedules of reinforcement.
- Q.5 Write any Two Short Notes. (14)
1. Techniques of relaxation.
 2. Purpose of behavior assessment.
 3. Assertiveness training.
 4. Contingency management.
